

પ્રેઝન્ટર

હેલો એન્ડ વેલકમ English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીચી...અને આજે મારી સાથે છે...

Sam

Hello, I'm Sam.

Phil

And I'm Phil. Welcome!

પ્રેઝન્ટર

મિત્રો, આજે વાત કરવી છે બાળક અને પિતાના વચ્ચેના સબંધ વિશે. શું તમને લાગે છે કે જે બાળકોના પિતા એમની સાથે વધારે સમય પસાર કરે છે એ બાળકો ઝડપથી બધી બાબતો ગ્રહણ કરે છે? તમે વિચારો ત્યાં સુધી ન્યૂઝ ક્લિપ સાંભળો, જેમાં આ વિશે વાત કરવામાં આવી છે.

News insert

An active male role in the early stages of babies' development produced better performance in cognitive tests by the age of two, researchers found. They say the findings show the value of early paternal involvement. Previous studies found that men tended to have a more stimulating, vigorous style, encouraging a child's risk-taking and exploration tendencies, which in turn might facilitate cognitive development.

પ્રેઝન્ટર

તો સંશોધન થકી બહાર આવ્યું છે કે પિતા જો બાળકો સાથે સમય પસાર કરે તો એ બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે. પણ મિત્રો શું તમને ખબર છે કે એક પિતા એના બાળકો સાથે સરેરાશ કેટલો સમય પસાર કરે છે? લંડન યુનિવર્સિટી અને સેવિલ્લા યુનિવર્સિટી દ્વારા એક અભ્યાસ થકી આ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમારા મતે પ્રશ્નનો જવાબ શું હોય શકે? તમારા ઓપ્શનસ્ છે: દિવસમાં 35 મિનીટ અથવા 45 મિનીટ.

Sam

Well, either way, it doesn't seem like a lot of time to spend with your child. Surely a child should spend at least an hour a day with their fathers!

Phil

An hour?! Really? Have you ever spent time with children? It's hard work!

Sam

If what the research says is true, fathers can help develop their child's cognitive development just by spending time with them.

પ્રેઝન્ટર

Cognitive development એ સંશોધનનું એવું ક્ષેત્ર છે જે બાળકોની વિચારવાની અને સમજવાની ક્ષમતા ઉપર કેન્દ્રિત છે.

Phil

But surely, fathers spending time with their children isn't the only thing that helps a child's cognitive development. What about their mothers?

પ્રેઝન્ટર

હું તમારી સાથે સહમત છું ફિલ. મારી બા દરરોજ મને શાળામાં જે ભણાવ્યું છે, એનો અભ્યાસ કરવામાં મારી મદદ કરતી હતી.

Sam

Well of course, mothers have an important role to play, but the research shows that a father's involvement, which is on the rise, has its own benefits.

Phil

Really, paternal involvement is on the rise?

પ્રેઝન્ટર

હા, 'Paternal' નો અર્થ થાય છે પિતાનો બાળકનાં સર્વાંગી વિકાસમાં ભાગીદારી. લંડન યુનિવર્સિટી અને સેવિલ્લા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ સંશોધન મુજબ 1970 ના દાયકામાં પિતા પોતાના બાળકો માટે માત્ર 5 મિનીટ સમય ફાળવતા હતાં.

હવે તમને આજનાં પ્રશ્નનો જવાબ જણાવીએ. લંડન યુનિવર્સિટી અને સેવિલ્લા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ સંશોધન મુજબ આધુનિક પિતા પોતાના બાળકો જોડે દૈનિક 35 મિનીટ જેટલો સમય પસાર કરે છે.

Sam

Wow, paternal involvement is only 35 minutes a day? That makes me so sad.

પ્રેઝન્ટર

પણ સેમ 1970 ના સમયગાળાનાં પ્રમાણે આજના પિતા પોતાના બાળકો જોડે 7 ગણો વધારે સમય પસાર કરે છે!

Sam

Yes, but still, I don't think it's enough. The news report mentioned that paternal involvement helps a child be a risk-taker.

પ્રેઝન્ટર

A risk-taker એટલે સાહસ ખેડનાર વ્યક્તિ. Are you a risk-taker Phil?

Phil

Sure, and I rarely spent time with my father growing up.

Sam

You're not a risk-taker! And what about exploration tendency? The news report told us that paternal involvement helps with developing a child's exploration tendency.

પ્રેઝન્ટર

Exploration tendency એટલે કંઈક નિરીક્ષણ કરવાની વૃત્તિ. આ એવી ટેવ છે જ્યાં વ્યક્તિ પોતાની રીતે વસ્તુઓ જુવે છે અને સમજવાનો પ્રયાસ કરે છે.

Phil

Another false claim. I'm always exploring to learn new things by myself, and again, I didn't spend much time with my father.

Sam

Stop lying to the audience Phil.

પ્રેઝન્ટર

મને લાગે છે કે સેમની વાતમાં તથ્ય છે.

Phil

What do you mean? I'm always learning things by myself and solving all of my own problems.

Sam

No, you don't. Whenever you come across a problem, the first thing you do is ask someone near you for an answer.

Phil

Yeah, and I actively look for answers.

Sam

Errg, I give up.

પ્રેઝન્ટર

મિત્રો, તમે આ બન્ને તરફ ધ્યાન ન આપો. શું તમને ખરેખર લાગે છે કે 'paternal involvement' એ બાળકનાં 'cognitive development' માં મદદરૂપ થાય છે?

આજે 'child development' અને 'paternal involvement' સાથે સંલગ્ન જે પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. 'Cognitive development' એ સંશોધનનું એવું ક્ષેત્ર છે જે બાળકોની વિચારવાની અને સમજવાની ક્ષમતા ઉપર કેન્દ્રિત છે જ્યારે 'paternal' નો અર્થ થાય છે પિતાનો બાળકનાં સર્વાંગી વિકાસમાં ભાગીદારી.

'Risk-taker' એટલે સાહસ ખેડનાર વ્યક્તિ અને 'exploration tendency' એટલે કંઈક નિરીક્ષણ કરવાની વૃત્તિ.

આવા જ બીજા રસપ્રદ ટોપિક્ સાથે ફરીથી મળીશું English Together માં. ત્યાં સુધી Bye!